

September 02, 2025

To,

BSE Ltd. Listing Department, P. J. Towers, Dalal Street, Mumbai – 400 001. (Scrip Code: Equity - 532144), (NCD – 960491 and 973309)	National Stock Exchange of India Ltd. Exchange Plaza, Bandra-Kurla Complex, Bandra (E), Mumbai – 400 051. (Symbol: WELCORP, Series EQ)
---	--

Dear Sir/ Madam,

Sub.: Newspaper Publication on the 100 Days' Campaign – “Saksham Niveshak”

Ref.: ISIN: INE191B01025

Please find enclosed herewith copies of the newspaper advertisement published informing about the 100 Days' Campaign – “Saksham Niveshak” launched by Investor Education and Protection Fund Authority.

A copy of the advertisement is also available on the website of the Company at www.welspuncorp.com

Please take the same on record.

Yours faithfully,
For **Welspun Corp Limited**

Kamal Rathi
Company Secretary and Compliance Officer
ACS-18182

Welspun Corp Limited

Welspun House, 5th Floor, Kamala City, Senapati Bapat Marg, Lower Parel (W), Mumbai 400013. India

T: +91 22 6613 6000 / 2490 8000 | F: +91 22 2490 8020

E-mail: companysecretary_wcl@welspun.com | Website: www.welspuncorp.com

Registered Address: Welspun City, Village Versamedi, Taluka Anjar, District Kutch, Gujarat 370110. India

T: +91 28 3666 2222 | F: +91 28 3627 9060

Corporate Identity Number: L27100GJ1995PLC025609

DHARANI SUGARS AND CHEMICALS LIMITED
Regd. Office: Top Floor, Surya Kiran Building 19 K G Marg, Connaught Place, Central Delhi, New Delhi, India, 110001
Tel: 011-44-20270711 To 011-44-20270715 Fax: 011-44-20270716 Email: info@dharaanisugars.com, website: www.dharaanisugars.com

NOTICE OF 98th ANNUAL GENERAL MEETING
NOTICE is hereby given that the 98th Annual General Meeting (AGM) of the Company will be held on **Thursday, September 25, 2025 at 11:00 AM (IST)** through Video Conferencing (VC)/Other Audio-Visual Means (OAVM) to transact the business as set forth in the Notice Pursuant to the General Circular No. 2024-25 dated August 28, 2025 and the 98th AGM of the Company is being held through VC. The deemed venue for the 98th AGM shall be the Registered Office of the Company. In compliance with the above said circulars, the Annual Report including the Audited Financial Results for the FY 2024-25, along with Notice of 98th AGM have been dispatched to the members of the Company who are registered with the Company Depository Participants (DPs). These documents are also available on the website of the Company at www.dharaanisugars.com. The Notice can also be accessed from the websites of the National Securities Depository Limited (www.nsdl.com) and Central Depository Services (India) Limited (www.cdsil.com). **Register of Members of the Company will remain closed from September 19th, 2025 to September 25th, 2025 (both days inclusive).**

The Company is providing the facility to its Members to exercise their right to vote on the business as set forth in the Notice of the 98th AGM by electronic means through both remote e-voting and e-voting at the AGM. All Members are informed that:

- Members may attend the 98th AGM through VOA/VAM on September 25, 2025 at 11:00 AM (IST). Please refer instructions annexed to the 98th AGM.
- Members whose names appear in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date of September 19, 2025 will only be entitled to avail the remote e-voting facility. Members who have not been registered with the Company as on the cut-off date of September 19, 2025 will not be allowed to vote. The remote e-voting shall not be allowed to start before **5:00 pm (IST)**, September 24, 2025 and once the vote on all resolutions is cast by the member, the member shall not be allowed to change. Subsequently, please refer instructions annexed to the 98th AGM.
- Members who have cast their vote by remote e-voting prior may attend the AGM through VOA/VAM, but shall not be entitled to cast their vote again. Members who have not cast their vote through remote e-voting and are present in the AGM through VOA/VAM, shall be entitled to vote through e-voting at the AGM.
- Members who have not registered their e-mail address are requested to register the same in respect of shares held in electronic form with the Depository through their Depository Participant(s) and in respect of shares held in physical form with Registrar & Share Transfer Agent (RTA) by visiting www.investors.camoindia.com.
- The Board or Directors appointed Messrs. M. Damodaran & Associates LLP Company Secretaries, Chennai as the scrutinizer for conducting e-voting process in fair and transparent manner.

The results of e-voting will be announced by the Company within two working days from the conclusion of AGM and also to be posted on the Stock Exchanges.

By the Order of Board of Directors
For DHARANI SUGARS AND CHEMICALS LIMITED
D. Palani G. Periasamy
Chairman

Place: Chennai
Date: September 2, 2025

HONASA CONSUMER LIMITED
CIN: 1749999/2016PLC06616
Regd. Office: Unit No-404, 4th Floor, City Centre, Plot No. 05, Sector-42, Dwarka, New Delhi-110 075
Corporate Office: 10th & 11th Floor, Capital Cybersec, Sector-59, Gurugram, Haryana - 122 102
E-mail: compliance@manacarearth.in
Telephone No: 011-44235442; Website: www.honasa.in

9th Annual General Meeting and E-Voting Information
Virtual Annual General Meeting

Notice is hereby given that 9th Annual General Meeting ("AGM") of the members of Honasa Consumer Limited ("Company") is scheduled to be held on Thursday, September 25, 2025 at 1:00 AM (IST) through Video Conferencing ("VC")/Other Audio-Visual Means ("OAVM") to transact the business as set forth in the Notice of 9th AGM ("Notice").

1. The Ministry of Corporate Affairs ("MCA") vide its circular no. 14/2020 dated April 8, 2020, 17/2020 dated April 13, 2020 and subsequent circulars issued in this regard latest being 09/2024 dated June 28, 2024 ("MCA Circulars") has permitted holding of AGM through VOA/VAM. In compliance with MCA circulars and relevant provisions of the Companies Act, 2013 ("Act"), 9th AGM of the Company will be held through VOA/VAM, without the presence of the members at a common venue. Members can join and participate in the 9th AGM through VOA/VAM facility only.

2. In accordance with MCA circulars and SEBI circular no. SEBI/HO/CFD/CFO-POD-2/CIR/2024/13 dated October 15, 2024 and SEBI Circular No. SEBI/HO/CFD/CFO-POD-2/CIR/2024/13 dated October 15, 2024, the Company has completed the dispatch of Notice and Annual Report for financial year 2024-25 ("Annual Report") on Monday, September 1, 2025 through electronic mode only to those members whose names are registered with the Depository as on the cut-off date of August 29, 2025. The requirement for sending physical copies of the Notice and Annual Report has been dispensed with vide MCA and SEBI circulars. Any member who wishes to obtain a physical copy of Notice and Annual Report may write to the Company at compliance@manacarearth.in from their registered e-mail address mentioning DR ID and Client ID. The Notice and Annual Report is available on the website of the Company at www.honasa.in/pages/investor. BSE Limited at www.bseindia.com, National Securities Depository Limited ("NSDL") at www.nsdl.com and Central Depository Services (India) Limited ("CDSL") at www.evotingindia.com. A letter providing the web-link, where the Annual Report 2024-25 is available, will be sent to those members whose e-mail address is not registered with the Depository Participant.

3. The Deemed venue of 9th AGM shall be the registered office of the Company i.e., Unit No-404, 4th Floor, City Centre, Plot No. 05, Sector-42, Dwarka, New Delhi - 110 075, India. Members participating through VOA/VAM shall be reckoned for the purpose of quorum under section 103 of the Act.

- E-Voting**
- Terms of the provisions of section 108 and other applicable provisions, if any, of the Act or the Companies (Management and Administration) Rules, 2014 and regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and the Secretarial Standard on the General Meetings (SSG) and MCA circulars. The Company is pleased to provide its members the facility of voting by electronic means ("E-Voting"), which includes both remote e-voting and e-voting at 9th AGM. This facility enables members to exercise their right to vote on the resolutions set forth in the Notice. The Company has appointed CDSL as an authorised agency to provide the facility of E-Voting. The detailed procedure for participation in the 9th AGM through VOA/VAM, along with instructions for remote e-voting and e-voting at 9th AGM, forms an integral part of the Notice.
 - Members holding shares, as on Thursday, September 18, 2025 ("Cut-off Date"), may cast their vote electronically on the business as set forth in the Notice through E-voting provided by CDSL. All members of the Company are informed that:
 - The Ordinary and Special Business as set forth in the Notice will be transacted only through E-voting.
 - The remote E-voting will commence on Sunday, September 21, 2025 at 9:00 AM (IST) and will end on Wednesday, September 24, 2025 at 5:00 PM (IST).
 - Once the vote on a resolution is cast by a member, the member shall not be allowed to change it subsequently or cast the vote again.
 - A person who has acquired shares and became a member of the Company after the dispatch of Notice and holding shares as on the Cut-off Date, may cast a vote by following the instructions for E-voting as provided in the Notice.
 - The members may note that: (a) The members who have cast their vote by remote E-voting prior to 9th AGM may participate in 9th AGM through VOA/VAM facility but shall not be entitled to cast their vote again through E-voting at 9th AGM. (b) The members participating in 9th AGM and who had not cast their vote by remote E-voting, shall be entitled to cast their vote through E-voting at 9th AGM. (c) A person whose name is recorded in the Register of Members or Register of Beneficial Owners maintained by the depositories as on the cut-off date shall only be entitled to avail the facility of remote E-voting, participate in 9th AGM through VOA/VAM facility and E-voting at 9th AGM.

Other Information

- The detailed procedure for the manner of registration of email address is provided in the notice to the Notice.
- If a member has any queries or issues regarding attending 9th AGM, E-voting from the CDSL, E-voting System, member may write to Mr. Rakesh Dahiya, Sr. Manager, Central Depository Services (India) Limited (CDSL), A Wing, 25th Floor, Maratha Finance, Matunga II, Mumbai - 400 013 or send an email to helpdesk.evoting@cdslindia.com or contact toll free no. 1800 211 0000.

The Company has appointed Mr. Shaali Shukla, Practising Company Secretary (Membership Number: FI2475) as the Scrutinizer for conducting the remote E-voting and E-voting at 9th AGM in a fair and transparent manner.

For Honasa Consumer Limited
Gaurav Pandey
Place: Gurugram
Date: September 2, 2025
Company Secretary & Compliance Officer
Membership No. FI3667

NORTH EASTERN CARRYING CORPORATION LIMITED
CIN: L51902DL1997PLC219485
Regd. Off: 900247, Ram Bagh Road, Azad Market, Delhi-110006
Tel. No: 011/25117516-19 Email: ce@necgroup.com
Website: www.necgroup.com

NOTICE is hereby given that the 40th Annual General Meeting ("AGM") of NORTH EASTERN CARRYING CORPORATION LIMITED ("Company") will be held on **Friday, September 26, 2025 at 11:30 AM (IST)** through Video Conferencing ("VC")/Other Audio-Visual Means ("OAVM") facility as per the provisions of the Companies Act, 2013 and the Rules framed thereunder read with General Circular No. 2024-25 dated May 13, 2024 read with other circulars, issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") and the provisions of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended, ("Listing Regulations") and the physical presence of the Members at a common venue to transact the business as set out in the Notice of AGM.

The dispatch of the Annual Report for the Financial Year 2024-25 along with the AGM Notice and E-voting procedure to the Members was completed on Monday, September 01, 2025.

The Annual Report has been sent electronically to those members, whose email addresses were available with the Company's Registrar and Transfer Agent, MAS Services Limited. For the members, who have not registered their email addresses, the procedure for registering their email has been provided in the Notice of AGM.

In terms of section 108 of the Act read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended and Regulation 44 of Listing Regulations, the Company is providing the facility to its Members to exercise their right to vote by electronic means on all of the business specified in the Notice convening the AGM of the Company (remote e-voting and e-voting during the meeting through e-voting services of National Securities Depository Limited ("NSDL"). The details pursuant to the Act are as under:

- Members holding shares either in physical form or in dematerialized form, as on the Cut-off Date i.e. Friday, September 25, 2025 ("eligible members"), can exercise their right to vote by using the remote e-voting and e-voting facility for all of the businesses specified in the Notice convening the AGM of the Company.
- The remote e-voting will commence on Tuesday, September 23, 2025 at 9:00 AM (IST).
- The remote e-voting will end on Thursday, September 25, 2025 at 5:00 PM (IST).
- The remote e-voting module shall be disabled for voting thereafter and once the vote on a resolution is cast by the member, he/she shall not be allowed to change it subsequently or cast the vote again.
- The Members can participate in the AGM even after exercising his right to vote through remote e-voting but shall not vote again in the AGM.
- The members, who remain present at the AGM and have not cast their vote through remote e-voting, shall be eligible to vote through e-voting system available during the AGM.
- Only a person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the cut-off date, shall be entitled to avail the facility of remote e-voting as well as e-voting in the AGM.
- In case the person becomes the Member of the Company after the cut-off date of the AGM Notice but on or before the cut-off date i.e. Friday, September 19, 2025, may obtain the login ID and password by following the procedure prescribed in the Notice of AGM. However, if a person is already registered with NSDL for e-voting then existing user ID and password can be used for casting vote.
- In case the AGM is available on the Company's website www.necgroup.com and also on the NSDL website www.evoting.nsdl.com.
- In case you have any queries or issues regarding e-voting, you may refer the frequently Asked Questions ("FAQs") and e-voting facility available on the website www.evotingindia.com or call on toll free no: 1800 1020 990 and 1800 224 340 or send a request to evoting@nsdl.com.
- The above information is being issued for the information and benefit of all the members of the Company and is in compliance with the MCA and the SEBI Circulars.

North Eastern Carrying Corporation Limited
Sd/-
Chairman & Managing Director

Date: September 01, 2025
Place: Delhi

ORIENT TECHNOLOGIES Limited
(Formerly known as Orient Technologies Private Limited)
CIN: L64200MH1997PLC109219
Registered Office: Plot No-502, 5th Floor, Akshat Sar, Central Road MDC, Opp. Akshat Central, Anand (East), Gandhinagar City, Mumbai, Maharashtra, India-400092
Tel. No: +91 22 4292 8888; Fax: +91 22 4292 8805 Website: www.orientindia.in; E-mail: compliance@orienttechnologies.net

INFORMATION REGARDING 28th ANNUAL GENERAL MEETING TO BE HELD THROUGH VIDEO CONFERENCING ("VC")/OTHER AUDIO-VISUAL MEANS ("OAVM")

Notice is hereby given that the 28th Annual General Meeting ("AGM") of the Members of Orient Technologies Limited ("the Company") will be held on **Tuesday, September 23, 2025 at 04:00 PM (IST)** through VOA/VAM, to transact the business as set forth in the Notice convening the meeting ("Notice"). In compliance with the applicable provisions of the Companies Act, 2013 ("Act") and relevant provisions of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations") and the provisions of the Companies Act, 2013 ("Act"), 28th AGM of the Company will be held through VOA/VAM, without the presence of the members at a common venue. Members can join and participate in the 28th AGM through VOA/VAM facility only.

2. In accordance with MCA circulars and SEBI circular no. SEBI/HO/CFD/CFO-POD-2/CIR/2024/13 dated October 15, 2024 and SEBI Circular No. SEBI/HO/CFD/CFO-POD-2/CIR/2024/13 dated October 15, 2024, the Company has completed the dispatch of Notice and Annual Report for financial year 2024-25 ("Annual Report") on Monday, September 1, 2025 through electronic mode only to those members whose names are registered with the Depository as on the cut-off date of August 29, 2025. The requirement for sending physical copies of the Notice and Annual Report has been dispensed with vide MCA and SEBI circulars. Any member who wishes to obtain a physical copy of Notice and Annual Report may write to the Company at compliance@orienttechnologies.net from their registered e-mail address mentioning DR ID and Client ID. The Notice and Annual Report is available on the website of the Company at www.orientindia.in/pages/investor. BSE Limited at www.bseindia.com, National Securities Depository Limited ("NSDL") at www.nsdl.com and Central Depository Services (India) Limited ("CDSL") at www.evotingindia.com. A letter providing the web-link, where the Annual Report 2024-25 is available, will be sent to those members whose e-mail address is not registered with the Depository Participant.

3. The Deemed venue of 28th AGM shall be the registered office of the Company i.e., Unit No-404, 4th Floor, City Centre, Plot No. 05, Sector-42, Dwarka, New Delhi - 110 075, India. Members participating through VOA/VAM shall be reckoned for the purpose of quorum under section 103 of the Act.

E-Voting

- Terms of the provisions of section 108 and other applicable provisions, if any, of the Act or the Companies (Management and Administration) Rules, 2014 and regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and the Secretarial Standard on the General Meetings (SSG) and MCA circulars. The Company is pleased to provide its members the facility of voting by electronic means ("E-Voting"), which includes both remote e-voting and e-voting at 28th AGM. This facility enables members to exercise their right to vote on the resolutions set forth in the Notice. The Company has appointed CDSL as an authorised agency to provide the facility of E-Voting. The detailed procedure for participation in the 28th AGM through VOA/VAM, along with instructions for remote e-voting and e-voting at 28th AGM, forms an integral part of the Notice.
- Members holding shares, as on Thursday, September 18, 2025 ("Cut-off Date"), may cast their vote electronically on the business as set forth in the Notice through E-voting provided by CDSL. All members of the Company are informed that:
- The Ordinary and Special Business as set forth in the Notice will be transacted only through E-voting.
- The remote E-voting will commence on Saturday, September 20, 2025, at 09:00 AM (IST) and will end on Monday, September 22, 2025 at 05:00 PM (IST). During this period, shareholders of the Company may cast their vote electronically. The remote e-voting module shall be disabled for voting thereafter.
- Members present at the meeting through VOA/VAM and who had not cast their votes on the resolutions shall be eligible to vote through e-voting system during the AGM. The instructions for attending the AGM through VOA/VAM are provided in the Notice of 28th AGM.
- The Members who have cast their vote by remote e-voting prior to the meeting may also attend the meeting but shall not be entitled to cast their vote again. Once a shareholder has cast their vote on a resolution, they shall not be allowed to change it thereafter.
- Detailed procedure for how to vote is provided in the Notice of the 28th Annual General Meeting. Any person who becomes a member of the Company after the dispatch of the Notice and holds shares of the Company as on the cut-off date i.e., Friday, September 18, 2025, may obtain his User ID and Password by sending an email to evoting@nsdl.com or compliance@orienttechnologies.net.
- In case you have any queries or issues regarding e-voting, you may refer the frequently Asked Questions and e-voting manual available at <https://www.evotingindia.com> under 'help section' or write an email to evoting@nsdl.com or compliance@orienttechnologies.net.
- Contact details for grievances connected with the facility for voting by electronic means:

Mr. Sukesh Shetty, Assistant Manager Email id: evoting@nsdl.com and Phone number: 022-48867000.

FOR ORIENT TECHNOLOGIES LIMITED
(Formerly known as Orient Technologies Private Limited)
Sd/-
Nayana Nair
Company Secretary and Compliance Officer
CIN-657573

Date: September 01, 2025
Place: Mumbai

SHARE INDIA CAPITAL SERVICES PRIVATE LIMITED
CIN: L65202MH2012PLC012537
Registered Office: Plot No. 1, Manu Jai Ventures Complex, Gurugram-122015
Email: ce@shareindia.com; Website: www.shareindia.com

NOTICE

Investor Education and Protection Fund Authority ("IEPFA") in line with the objectives of the Securities and Exchange Board of India ("SEBI") and its broader drive for investor education and facilitation, has launched a "100 Days Campaign-Saksham Niveshak" from July 28, 2025 to November 06, 2025, for shareholders whose dividends have remained unclaimed. In this regard, NDR Auto Components Limited ("the Company") has initiated "100 Days Campaign-Saksham Niveshak" and this notice is being issued by the Company as part of the aforesaid campaign.

All the shareholders who have unclaimed dividend or those who are required to update their 'Know Your Client' ("KYC"), Bank/Nomination details/ contact information (email, mobile no. address), etc. may write to the Company's Registrar and Share Transfer Agent, La. Beal Financial & Commercial Services Private Limited, Beal House, 3rd Floor, 301, 11062 Phone: 011/29912261 Email id: beal@bealfinancial.com.

Further, shareholders holding shares in dematerialized form are requested to contact their respective Depository Participant to update the KYC, Bank/Nomination details.

This campaign is specifically to reach out to the shareholders to update their KYC, Bank/Nomination details and to claim their unclaimed dividend shares and to ensure timely receipt of dividend and to avoid transfer of shares and dividend to the EEPF Authority.

We urge all shareholders to take prompt action during the campaign period to safeguard their entitlement and ensure compliance with statutory requirements.

For Share India Capital Services Private Limited
Sd/-
Raj Baheti
Company Secretary
FCS: 3401

Place: Gurugram
Date: 01/09/2025

NDR AUTO COMPONENTS LIMITED
CIN: L23004DL2019PLC34740
Registered Office: Bhabha, Regus Cadiz Commercial Tower, 3rd Floor, Sector 29, Connaught Place, New Delhi-110037
Corporate Office: Plot No. 1, Manu Jai Ventures Complex, Gurugram-122015
Email: ce@ndrauto.com; Tel No: +91 94333387-4 Website: www.ndrauto.com

NOTICE

Investor Education and Protection Fund Authority ("IEPFA") in line with the objectives of the Securities and Exchange Board of India ("SEBI") and its broader drive for investor education and facilitation, has launched a "100 Days Campaign-Saksham Niveshak" from July 28, 2025 to November 06, 2025, for shareholders whose dividends have remained unclaimed. In this regard, NDR Auto Components Limited ("the Company") has initiated "100 Days Campaign-Saksham Niveshak" and this notice is being issued by the Company as part of the aforesaid campaign.

All the shareholders who have unclaimed dividend or those who are required to update their 'Know Your Client' ("KYC"), Bank/Nomination details/ contact information (email, mobile no. address), etc. may write to the Company's Registrar and Share Transfer Agent, La. Beal Financial & Commercial Services Private Limited, Beal House, 3rd Floor, 301, 11062 Phone: 011/29912261 Email id: beal@bealfinancial.com.

Further, shareholders holding shares in dematerialized form are requested to contact their respective Depository Participant to update the KYC, Bank/Nomination details.

This campaign is specifically to reach out to the shareholders to update their KYC, Bank/Nomination details and to claim their unclaimed dividend shares and to ensure timely receipt of dividend and to avoid transfer of shares and dividend to the EEPF Authority.

We urge all shareholders to take prompt action during the campaign period to safeguard their entitlement and ensure compliance with statutory requirements.

For NDR Auto Components Limited
Sd/-
Rajal Shandani
Executive Director & Company Secretary

Place: Gurugram
Date: September 01, 2025

BHARAT SEATS LIMITED
CIN: L34300DL1998PLC023540
Registered Office: 1, Nelson Mandela Road, Vasant Kunj, New Delhi-110070
Corporate Office: Plot No. 1, Manu Jai Ventures Complex, Gurugram-122015
Phones: +91 96433387-4 E-mail: investorrelations@bharatseats.net
CIN: L34300DL1998PLC023540 Website: www.bharatseats.net

NOTICE

Investor Education and Protection Fund Authority ("IEPFA") in line with the objectives of the Securities and Exchange Board of India ("SEBI") and its broader drive for investor education and facilitation, has launched a "100 Days Campaign-Saksham Niveshak" from July 28, 2025 to November 06, 2025, for shareholders whose dividends have remained unclaimed. In this regard, Bharat Seats Limited ("the Company") has initiated "100 Days Campaign-Saksham Niveshak" and this notice is being issued by the Company as part of the aforesaid campaign.

All the shareholders who have unclaimed dividend or those who are required to update their 'Know Your Client' ("KYC"), Bank/Nomination details/ contact information (email, mobile no. address), etc. may write to the Company's Registrar and Share Transfer Agent, La. Beal Financial & Commercial Services Private Limited, Beal House, 3rd Floor, 301, 11062 Phone: 011/29912261 Email id: beal@bealfinancial.com.

Further, shareholders holding shares in dematerialized form are requested to contact their respective Depository Participant to update the KYC, Bank/Nomination details.

This campaign is specifically to reach out to the shareholders to update their KYC, Bank/Nomination details and to claim their unclaimed dividend shares and to ensure timely receipt of dividend and to avoid transfer of shares and dividend to the EEPF Authority.

We urge all shareholders to take prompt action during the campaign period to safeguard their entitlement and ensure compliance with statutory requirements.

For Bharat Seats Limited
Sd/-
Raj Baheti
Company Secretary
FCS: 3401

Place: Gurugram
Date: 01/09/2025

Welspun Corp. WELSPUN CORP LIMITED
(Corporate Identification Number - L27100KA1995PLC026069)
Regd. Office: Welspun House, Village Vengal Rao, Hyderabad-500003
Tel No: +91 9288 82222 Fax: +91 2836 279600
Company Secretary: WCL@welspun.com; Website: www.welspuncorp.com

NOTICE TO SHAREHOLDERS

100 Days Campaign- "Saksham Niveshak"

Investor Education and Protection Fund Authority ("IEPFA") in line with the objectives of the Securities and Exchange Board of India ("SEBI") and its broader drive for investor education and facilitation, has launched a "100 Days Campaign-Saksham Niveshak" from July 28, 2025 to November 6, 2025, for shareholders whose dividends have remained unclaimed. As per the directive of IEPFA, Issued by the Company as part of the aforesaid campaign.

All the shareholders who have unclaimed dividend or those who are required to update their 'Know Your Client' ("KYC") and nomination details/ contact information related to unclaimed dividend and shares, are requested to write to the Company's Registrar and Share Transfer Agent (RTA) at MFGU Intime Private Limited (formerly known as Intime India Private Limited), Link, Welspun Group Limited, 421 Park, L.B.S. Marg, Vikhali, Mumbai - 400033. Tel: 022-49189000. Email: helpdesk@intimepm.com. The Shareholders may further note that this campaign has been initiated specifically to reach out to the shareholders to update their KYC details. The shareholders are requested to update their details and claim their unclaimed dividend to the extent to prevent their shares from being transferred to the IEPFA.

This notice is also available on the Company's website at www.welspuncorp.com.

For Welspun Corp Limited
Sd/-
Kamal Rathi
Company Secretary

Mumbai, September 1, 2025

(THIS IS NOT AN OFFER DOCUMENT. THIS IS A CORRIGENDUM TO THE RED HERRING PROSPECTUS DATED AUGUST 26, 2025 AND THE ADVERTISEMENT PUBLISHED DATED AUGUST 27, 2025.)

PUBLIC ANNOUNCEMENT

OPTIVALE TEK CONSULTING LIMITED
CIN: U72200DL201PLC221539

Our Company was originally incorporated as "Optivale Tek Consulting Private Limited" under the provisions of Companies Act, 1956 vide Certificate of Incorporation dated June 27, 2011 bearing Corporate Identification Number U72200DL201PLC221539 issued by the Registrar of Companies, Delhi and Haryana. Further, our Company was converted to a public limited company pursuant to a special resolution passed by our shareholders at the EGM held on May 22, 2024 and consequently the name of our Company was changed to "Optivale Tek Consulting Limited" and a fresh certificate of incorporation was issued by the Registrar of Companies, Delhi and Haryana dated September 16, 2024. As on date of this Red Herring Prospectus, the Corporate Identification Number of our Company is U72200DL201PLC221539. "Our History and Certain Corporate Matters" beginning on page 148 of the Red Herring Prospectus.

Registered Office: 067 06 Floor, Surya Kiran Building 19 K G Marg, Connaught Place, Central Delhi, New Delhi, India, 110001
Tel. No: 011-35752659; Email: ce@optivaletek.com; Website: www.optivaletek.com
Contact Person: Mrs. Shaboni Chatterjee, Company Secretary and Compliance Officer;

OUR PROMOTERS: MR. ASHISH KUMAR AND MS. RAGINI JHA

THE OFFER*

INITIAL PUBLIC OFFERING OF UP TO 61,89,600 EQUITY SHARES OF FACE VALUE OF ₹10/- EACH ("EQUITY SHARES") OF OPTIVALE TEK CONSULTING LIMITED ("OPTIVALE" OR "OUR COMPANY") FOR THE ISSUE ("THE ISSUE") FOR CASH AT A PRICE OF ₹ (-) / - PER EQUITY SHARE (INCLUDING A PREMIUM OF ₹ (-) / - PER EQUITY SHARE ("ISSUE PRICE") AGGREGATING TO ₹ (-) / - LAKHS ("THE ISSUE") BY OUR COMPANY. THE ISSUE COMPREHENSES A RESERVATION OF WHICH UP TO 13,13,000 EQUITY SHARES OF ₹10/- EACH WILL BE RESERVED FOR SUBSCRIPTION BY MARKET MAKER OBSERVATIONS PORTION AND A NET ISSUE TO THE PUBLIC OF 58,76,600 EQUITY SHARES OF ₹10/- EACH IS HEREBY REFERRED TO AS THE NET ISSUE. THE ISSUE AND THE NET ISSUE WILL CONSTITUTE (I) AND (J) RESPECTIVELY OF THE POST ISSUE PAID UP EQUITY SHARE CAPITAL OF THE COMPANY. THE FACE VALUE OF THE EQUITY SHARES IS ₹10/- EACH. THE PRICE BAND AND THE MINIMUM BID LOT WILL BE DECIDED BY OUR COMPANY IN CONSULTATION WITH THE BRLM ADVERTISED IN ALL EDITIONS OF A WIDELY CIRCULATED ENGLISH NATIONAL DAILY NEWSPAPER OF FINANCIAL INTERESTS. ALL EDITIONS OF A WIDELY CIRCULATED HINDI NATIONAL DAILY NEWSPAPER JANSATTA (HINDI BEING THE REGIONAL LANGUAGE OF WHERE OUR REGISTERED OFFICE IS LOCATED) AT LEAST TWO WORKING DAYS PRIOR TO THE ISSUE OPENING DATE AND SHALL BE MADE AVAILABLE TO THE NATIONAL STOCK EXCHANGE OF INDIA LIMITED "NSE" FOR THE PURPOSE OF UPLOADING ON THEIR WEBSITE. FOR FURTHER DETAILS, PLEASE REFER TO "ISSUE STRUCTURE" BEGINNING ON PAGE 218 OF THIS RED HERRING PROSPECTUS.

CORRIGENDUM TO THE RED HERRING PROSPECTUS DATED AUGUST 26, 2025

This is with reference to the Red Herring Prospectus (RHP) dated August 26, 2025 and the advertisement dated August 27th, 2025 to the proposed initial Public Offering (IPO) of Optivale Tek Consulting Limited.

Investors are hereby informed of the following revisions in the Issue Procedure on page 222 of RHP:

- Allocation of Equity Shares to Investors other than Individual Investors may be on proportionate basis. No Individual Investor will be allotted less than the minimum Bid Lot subject to availability of shares in Individual Investor Category and the remaining available shares, if any will be allotted on a proportionate basis. Our Company is required to receive a minimum subscription of 90% of the Issue.
- Flow of Events from the closure of bidding period (DAY T) Afloatment:

 - On T day, RTA to validate the electronic bid details with the depository records and also reconcile the final certificates received from the Sponsor Bank for L1/1 process and the SCGS for ASBA and Syndicate ASBA process with the electronic bid details.
 - RTA identifies cases with mismatch of account number as per bid file/ Final Certificate and as per applicant's bank account linked to depository detail account and seek clarification from SCGS to identify the applicants with third party account for rejection.
 - Third party confirmation of applications to be completed by SCGS on T+1 day.
 - RTA prepares the list of final rejections and circulate the rejections list with Book Running Lead Manager (s) / Company for their review/ comments.
 - Post rejection, the RTA submits the basis of allotment with the Designated Stock Exchange (DSE).
 - The Designated Stock Exchange (DSE), post verification approves the basis and generates drawal of lots wherever applicable, through a random number generation software.
 - The NSE uploads the drawal numbers in their system and generates the final list of allottees as per process mentioned below.

- Process for generating list of allottees -**
- Instruction is given by RTA in their Software System to reverse category wise all the application numbers in the ascending order and generate the bucket, batch as per the allotment ratio. For example, if the application number is 78654321 then system reverses it to 12345678 and the ratio of allottees to applicants in a category is 2:7 then the system will create lots of 7. If the drawal of lots provided by Designated Stock Exchange (DSE) is 3 and 5 then the system will pick every 3rd and 5th application in each of the lot of the category and these applications will be allotted the shares in that category.
 - In categories where there is disproportionate allotment, the Registrar will prepare the proportionate working based on the category.
 - In categories where there is undersubscription, the Registrar will do full allotment for all valid applications.
 - On the basis of the above, the RTA will work out the allottees, partial allottees and non-allottees, prepare the final transfer letters and advise the SCGS to debit or unlock the respective accounts.
- Allotment of shares will be done on the basis of the above mentioned process.
- The changes set out above are to be read in conjunction with the RHP dated August 26, 2025 and Advertisement dated August 27, 2025 and accordingly, all references to the information in the RHP Admitted Prospectus, DSE Application Forms stands amended pursuant to this Corrigendum. Investors should read this Corrigendum along with the RHP before making an investment decision with respect to the Offer.

BOOK RUNNING LEAD MANAGER TO THE OFFER	REGISTRAR TO THE ISSUE	COMPANY SECRETARY AND COMPLIANCE OFFICER
Share India SHARE INDIA CAPITAL SERVICES PRIVATE LIMITED A-25, Basement, Sector-04, Noida, 201301, Uttar Pradesh, India Address: 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139, 140, 141, 142, 143, 144, 145, 146, 147, 148, 149, 150, 151, 152, 153, 154, 155, 156, 157, 158, 159, 160, 161, 162, 163, 164, 165, 166, 167, 168, 169, 170, 171, 172, 173, 174, 175, 176, 177, 178, 179, 180, 181, 182, 183, 184, 185, 186, 187, 188, 189, 190, 191, 192, 193, 194, 195, 196, 197, 198, 199, 200, 201, 202, 203, 204, 205, 206, 207, 208, 209, 210, 211, 212, 213, 214, 215, 216, 217, 218, 219, 220, 221, 222, 223, 224, 225, 226, 227, 228, 229, 230, 231, 232, 233, 234, 235, 236, 237, 238, 239, 240, 241, 242, 243, 244, 245, 246, 247, 248, 249, 250, 251, 252, 253, 254, 255, 256, 257, 258, 259, 260, 261,		

- (1) સાંગલાનુના ઓચોર રોડનું રૂપિયા ૫૦.૦૦ લાખના ખર્ચે બનાર કામનું ખાતમુહૂર્ત સમાપ્ત-રજા : સપ્તારે ૧૦.૩૦ વાગ્યે, સાંગલાનુ ગામે
- (2) માહાકાશના ઓચોર રોડનું રૂપિયા ૬૦.૦૦ લાખના ખર્ચે નિર્માણ બનાર કામનું ખાતમુહૂર્ત સમાપ્ત-રજા : સપ્તારે ૧૧.૦૦ વાગ્યે, માહાકાશ ગામે
- (3) સુમરા-સોલાવના રોડનું રૂપિયા ૧૦.૦૦ લાખના ખર્ચે નિર્માણ બનાર કામનું ખાતમુહૂર્ત સમાપ્ત-રજા : બુધ્વારે ૧૨.૦૦ વાગ્યે, સોલાવ ગામે
- (4) અંબિયા ઓચોર રોડનું રૂપિયા ૬૦.૦૦ લાખના ખર્ચે નિર્માણ બનાર કામનું ખાતમુહૂર્ત સમાપ્ત-રજા : બુધ્વારે ૦૩.૦૦ વાગ્યે, અંબિયા ગામે
- (5) ખડિયા ઓચોર રોડનું રૂપિયા ૩૦.૦૦ લાખના ખર્ચે નિર્માણ બનાર કામનું ખાતમુહૂર્ત સમાપ્ત-રજા : સપ્તારે ૦૪.૦૦ વાગ્યે, ખડિયા ગામે
- (6) ઝાઝા ડુંગર ઓચોર રોડનું રૂપિયા ૧૨૫.૦૦ લાખના ખર્ચે નિર્માણ બનાર કામનું ખાતમુહૂર્ત સમાપ્ત-રજા : સપ્તારે ૦૫.૦૦ વાગ્યે, ઝાઝા-ઝાઝા ગામે

પૂર્ણ મહેસાના ની પ્રધુમુનાનંદિ એમ. પટેલ (ગામ, ધારાસભ્યશ્રી, ૦૧-અબડાસરા)

અનિર્વાચકોના નામ

<ul style="list-style-type: none"> ● શ્રીમતી દયાબા પટેલ (ગામ,પ્રમુખશ્રી, તા.પં.લખવત) ● શ્રી પુનરાવરિત શીખ (ગામ,કેળવણીશ્રી, તા.પં.લખવત) ● શ્રી ધારાસરા સોલંકી (ગામ,રેગેશનશ્રી, સવારના અર્ધે સપ્તારે) ● શ્રી દીપકભાઈ પટેલ (ગામ,કેડશ્રી, સવારના અર્ધે સપ્તારે) ● શ્રી દેવેન્દ્રભાઈ પટ્ટણી (ગામ,સરકારી, તા.પં.લખવત) 	<ul style="list-style-type: none"> ● શ્રીમતી ભૂવણીબેઈ રવણી (ગામ,ક.રેગેશનશ્રી, તા.પં.લખવત) ● શ્રીમણી અરવિંદ પટેલ (ગામ,વાણવત રેગેશનશ્રી, તા.પં.લખવત) ● શ્રી પુણભાઈ પટેલ (ગામ,સરકારી, તા.પં.લખવત) ● શ્રીમતી હાપુબેઈ કટારા (ગામ,સરકારી, તા.પં.લખવત)
--	---

અમલક

<p>શ્રી જેતમાલા પટેલ (ગામ,કામચીની, સવારના અર્ધે સપ્તારે)</p>	<p>શ્રી નકાનાનારા રાજગીર (સવારના અર્ધે સપ્તારે, ગામ) સવારના અર્ધે સપ્તારે અમલકી નકાના રાજી પટેલ (સવારના અર્ધે સપ્તારે)</p>	<p>શ્રી ચીડલાનાઈ પટેલ (ગામ,કામચીની, સવારના અર્ધે સપ્તારે)</p>
---	---	--